

The first Arab-India Energy Forum (June 8-9, 2021)

June 09, 2021

પ્રથમ આરબ- ઈન્ડિયા એનર્જી ફોરમ (જૂન 8-9, 2021)

જૂન 09, 2021

1. આરબ-ઈન્ડિયા એનર્જી ફોરમ (એઆઈઈએફ)ની પ્રથમ આવૃત્તિ ભારત અને કિંગડમ ઓફ મોરક્કોના સહઅધ્યક્ષપદે 8-9 જૂન 2021ના રોજ વર્ચ્યુઅલ સ્વરૂપે યોજાઈ હતી. આ કાર્યક્રમ આરબ-ઈન્ડિયા કોઓપરેશન ફોરમ (એઆઈસીએફ)ના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના અમલીકરણ તરીકે હતો, જેનો નિર્ણય 12 જાન્યુઆરી 2021ના રોજ ભારતના વરિષ્ઠ અધિકારીઓ અને લીગ ઓફ આરબ સ્ટેટ્સ (એલએએસ)ના અધિકારીઓ વચ્ચેની વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો હતો.
2. ફોરમના ઉદ્ઘાટન સત્રને મહામહિમ શ્રી આર. કે. સિંઘ, રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) ઉર્જા, ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રી, મહામહિમ અઝિઝ રબ્બાહ, મોરક્કોના ઉર્જા, ખાણ અને પર્યાવરણ મંત્રી, અને મહામહિમ ડો. કમાલ હસન અલી, એલએએસના આર્થિક બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલે સંબોધન કર્યું હતું. ત્યાર પછીના સત્રોમાં એનર્જી ટ્રાન્ઝિશન, ઈન્ટ્રા-રિજનલ પાવર ટ્રેડિંગ, હાઈડ્રોકાર્બન અને આણુ ઉર્જા ઉત્પાદન અંગે સહકારની સંભાવના અને પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેના માટે પેનલિસ્ટોને ભારત અને એલએએસ સભ્ય દેશોની જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાંથી તથા મહત્વના પ્રાદેશિક સંગઠનો, જેવા કે ઓર્ગેનાઈઝેશન ઓફ આરબ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓએપીએસી) અને આરબ એટોમિક એનર્જી એજન્સી (એએઈએ) વગેરેમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.
3. ફોરમમાં વિવિધ આર્થિક સેક્ટર માટે ઉર્જા કાર્યક્ષમતા કાર્યક્રમોના ક્ષેત્ર, નવી અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ઝડપી વિકાસ, પ્રાદેશિક સત્તાની હિસ્સેદારીની ગોઠવણ, ઓઈલ રિકવરીમાં વધારો, ગેસના ઉત્પાદનમાં વધારો તથા સુરક્ષિત આણુ ઉર્જા ઉત્પાદન વગેરે ક્ષેત્રમાં જ્ઞાન, કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન થયું હતું. આ ઉપરાંત આ સેક્ટરમાં લાગુ પડતી વિવિધ દેશોની નેશનલ રેગ્યુલેટરી નીતિઓ, રોકાણની તક તથા આર એન્ડ ડી અને તાલીમ સહયોગની સંભાવનાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
4. નિષ્ણાતોએ એ બાબતની નોંધ લીધી હતી કે ભારત અને એલએએસના કેટલાક સભ્ય દેશો સ્વચ્છ અને ગ્રીન એનર્જી અર્થતંત્ર તરફ જવા માંગે છે છતાં, નજીકના ભવિષ્યમાં હાઈડ્રોકાર્બન પર તેઓ નિર્ભર રહેવાનું ચાલુ રાખશે.
5. અંતમાં સહભાગીઓએ આ ફોરમનું સહઅધ્યક્ષપદ સંભાળવા બદલ બંને મંત્રીઓને બિરદાવ્યા હતા. તેમણે આટલો મહત્વનો કાર્યક્રમ યોજવા માટે ઉત્તમ સંકલન કરવા બદલ એલએએસના જનરલ સેક્રેટરિયેટનો આભાર પણ માન્યો હતો.

6.तेओ वरु 2003डरु डररतडरु अेअरुठरुअेकुनी डीखु अरुवृतरु डुडुवरु डरुडे सरुडडत थडरु उतरु.

नवी दुरलुडु

खुन 09, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.